



RAN-2408000604050005

S.Y.B.Com. (NCF-NEP) (Sem.-IV) Examination October - 2025
SEC-Banking-II

Time: 1 Hour]

[Total Marks: 25

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
 Fill up strictly the above details on your answer book

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર.1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો (ગમે તે પાંચ)

10

1. મુખ્ય હકીકત પત્રક (KFT) શું છે?
2. લોનનો અર્થ શું છે?
3. લોનમાં છુપાયેલા ચાર્જ શું છે?
4. વિલીનીકરણના કોઈપણ ચાર ઉદ્દેશ્યોનો ઉલ્લેખ કરો.
5. વિલીનીકરણ નાણાકીય સ્થિરતાને કેવી રીતે મજબૂત બનાવે છે ? સમજાવો
6. લોનમાં વાર્ષિક ટકાવારી દરના કોઈપણ ચાર ઉપયોગો સમજાવો.
7. બેંકોના રાષ્ટ્રીયકરણનો અર્થ શું છે?

પ્ર.2. અ. બેંક વિલીનીકરણ દરમિયાન સામનો કરવામાં આવતા પડકારોને વિગતવાર સમજાવો.

8

બ. સ્ટાર્ટઅપ લોન મેળવવા માટે જરૂરી માપદંડોને વિગતવાર સમજાવો.

7

અથવા

પ્ર.2. અ. લોન મંજૂરીમાં CIBIL સ્કોરનું મહત્વ વિગતવાર સમજાવો.

8

બ. તમારો અભિપ્રાય આપો.

7

1. કુમારી રીયા દેનાબેંક, સુરતમાં ખાતું ધરાવે છે. હાલમાં આ બેંકનું બેંક ઓફ બરોડામાં વિલીનીકરણ થતાં પહેલા ચેકબુક દેનાબેંક ના નામની ઈસ્યુ કરવામાં આવી હતી, જ્યારે ચેક કોઈ પાર્ટીના નામે લખે તો તે ચેક નકારતો હતો. બેન્કર તરીકે તમે શું કરશો?
2. અનન્યા, એક યુવાન વ્યાવસાયિક, ને લાગે છે કે વિલીનીકરણ પછી બેંકની સેવા ફીમાં વધારો થયો છે. તેના માસિક સેવા શુલ્ક અને ATM ફીમાં વધારો થયો છે, જેના કારણે નાણાકીય તણાવ વધી રહ્યો છે. બેંકર તરીકે તમે શું કરશો?

ENGLISH VERSION

Q.1. Answer the following questions. (Any Five)

10

1. What is a Key Fact Statement (KFT)?
2. What do you mean by loan?
3. What are Hidden Charges in loans?

4. Mention any four objectives of mergers.
5. How do mergers strengthen Financial Stability? Explain.
6. Explain any four uses of Annualized Percentage Rate in loan.
7. What does nationalization of banks mean?

- Q.2.** **a.** Explain, in detail, the challenges faced during a bank merger. **8**
 b. Explain, in detail, the criteria required for getting a startup loan. **7**

OR

- Q.2.** **a.** Explain the importance of CIBIL score in loan approval, in detail. **8**
 b. Provide your opinion as a banker in the following situations: **7**
1. Miss Riya has an account in Dena Bank, Surat. Before the recent merger of this bank with Bank of Baroda, the cheque book was issued in the name of Dena Bank. When the cheque was written in the name of any party, the cheque was rejected. What will you do as a banker?
 2. Ananya, a young professional, finds that the bank's service fees have increased after the merger. Her monthly service charges and ATM fees have gone up, leading to financial strain. What will you do as a banker?
